

Signature of Invigilators

Roll No.

--	--	--	--	--

1.

PHYSICAL EDUCATION

(In figures as in Admit Card)

2.

Paper II

Roll No.

(In words)

D—2102

Name of the Areas/Section (if any)

Time Allowed : 75 Minutes]

[Maximum Marks : 100

Instructions for the Candidates

1. Write your Roll Number in the space provided on the top of this page.
2. This paper consists of *fifty (50)* multiple choice type questions. *All* questions are compulsory.
3. Each item has upto four alternative responses marked (A), (B), (C) and (D). The answer should be a capital letter for the selected option. The answer letter 'A' should entirely be contained within the corresponding square.

Correct method Wrong Method or

4. Your responses to the items for this paper are to be indicated on the ICR Answer Sheet under paper II only
5. Read instructions given inside carefully.
6. One sheet is attached at the end of the booklet for rough work.
7. You should return the test booklet to the invigilator at the end of paper and should not carry any paper with you outside the examination hall.

પરીક્ષાર્થીઓ માટે સૂચનાઓ :

૧. આ પૃષ્ઠના ઉપલા ભાગે આપેલી જગ્યામાં તમારી ક્રમાંક સંખ્યા (રોલ નંબર) લખો.
૨. આ પ્રશ્નપત્રમાં ૫૦ (પચાસ) બહુવૈકલ્પિક ઉત્તરોવાળા પ્રશ્નો છે. બધા જ પ્રશ્નોના ઉત્તરો આપવા ફરજિયાત છે.
૩. પ્રત્યેક વિગતના (A), (B), (C) અને (D) એવા ચાર સંભવિત ઉત્તરો આપવામાં આવ્યા છે. તમે સ્વીકારેલા વિકલ્પનો ઉત્તર કેપિટલ (પહેલી એબીસીડી) અક્ષરમાં આપવાનો રહેશે. તમારા ઉત્તર આપેલા ચોરસમાં સરખી રીતે લખવા.

સાચી પદ્ધતિ : ખોટી પદ્ધતિ : ,

૪. આ પ્રશ્નપત્રના ઉત્તરો આઈસીઆરના ઉત્તરપત્રકમાં Paper II ની નીચે લખવાના રહેશે.
૫. અંદર આપેલી સૂચનાઓ ધ્યાનથી વાંચો.
૬. આ ઉત્તરપોથીને અંતે આપેલું પૃષ્ઠ કાચા કામ માટે છે.
૭. પ્રશ્નપત્ર લખાઈ રહે એટલે આ ઉત્તરપોથી તમારા નિરીક્ષકને આપી દેવી. પરીક્ષાખંડની બહાર કોઈપણ પ્રશ્નપત્ર લઈ જવું નહીં.

SEAL

The first part of the report deals with the general conditions of the country during the year. It is noted that the weather was generally favorable, with a moderate amount of rain and a moderate temperature. The crops were generally well advanced, and the harvest was expected to be a good one. The stock raising industry was also doing well, and the price of wool was high. The trade was generally brisk, and the country was in a state of prosperity.

The second part of the report deals with the various industries of the country. It is noted that the wool industry was the most important, and that the price of wool was high. The sheep raising industry was also doing well, and the number of sheep was increasing. The cattle raising industry was also doing well, and the number of cattle was increasing. The horse raising industry was also doing well, and the number of horses was increasing. The various other industries of the country were also doing well, and the country was in a state of prosperity.

The third part of the report deals with the various public works of the country. It is noted that the roads were generally in good condition, and the bridges were well maintained. The water supply was generally adequate, and the drainage system was well maintained. The various other public works of the country were also well maintained, and the country was in a state of prosperity.

The fourth part of the report deals with the various social and educational institutions of the country. It is noted that the schools were generally well attended, and the teachers were well qualified. The various other social and educational institutions of the country were also well maintained, and the country was in a state of prosperity.

The fifth part of the report deals with the various financial institutions of the country. It is noted that the banks were generally well capitalized, and the interest rate was low. The various other financial institutions of the country were also well maintained, and the country was in a state of prosperity.

The sixth part of the report deals with the various political institutions of the country. It is noted that the government was generally well run, and the various political institutions of the country were also well maintained, and the country was in a state of prosperity.

The seventh part of the report deals with the various other institutions of the country. It is noted that the various other institutions of the country were also well maintained, and the country was in a state of prosperity.

PHYSICAL EDUCATION

શારીરિક શિક્ષણ

PAPER-II

પ્રશ્નપત્ર-II

Note :— (i) This paper contains fifty (50) multiple-choice, true or false and matching type questions.

(ii) Attempt *all* questions.

(iii) Each question carries two (2) marks.

સૂચના : (i) આ પ્રશ્નપત્રમાં **પચાસ (૫૦)** બહુવિકલ્પીય પ્રશ્નો, સાચું-ખોટું અને જોડકાં બનાવવાના પ્રશ્નો છે.

(ii) તમામ પ્રશ્નોના જવાબ લખવાના છે.

(iii) પ્રત્યેક પ્રશ્નના બે (૨) ગુણ છે.

1. Philosophy is related to :

(A) Functions of mind

(B) Human behaviour

(C) Love of Wisdom

(D) Social Traditions

તત્વજ્ઞાન સંકળાયેલ છે :

(A) મનના કાર્ય સાથે

(B) માનવીના વર્તન સાથે

(C) વિદ્વતા પ્રત્યે પ્રેમ.

(D) સામાજિક રિવાજો

2. Plato was the father of :

(A) Realism

(B) Pragmatism

(C) Idealism

(D) Naturalism

પ્લેટો પિતા હતો :

(A) વાસ્તવવાદ

(B) પ્રેગમેટીઝમ

(C) આદર્શવાદ

(D) પ્રાકૃતવાદ

3. Modern Olympic Games were revived by :

(A) Abraham Lincoln

(B) Parry Obrien

(C) Barron Pierre de Coubertin

(D) George Washington

આધુનિક ઓલિમ્પિક શરૂ કરનાર :

(A) અબ્રાહમ લિંકન

(B) પેરી ઓબ્રાઈન

(C) બેરન પીયર ડી કુબરટીન

(D) જ્યોર્જ વોશિંગ્ટન

4. The gap between two Olympic Games is :
- (A) Two years (B) Four years
(C) Six years (D) Seven Years
- બે ઓલિમ્પિક વચ્ચેનો સમય ગાળો :
- (A) બે વર્ષ (B) ચાર વર્ષ
(C) છ વર્ષ (D) સાત વર્ષ
5. Biological basis of life is :
- (A) Muscle (B) Bone
(C) Cell (D) Tissue
- જીવનના જીવવિદ્યાનો પાયો :
- (A) સ્નાયુ (B) હાડકા
(C) કોષ (D) પેશીજાલ
6. The longest muscle in the human body is :
- (A) Biceps (B) Triceps
(C) Sartorius (D) Rectus abdominus
- માનવ શરીરમાં સૌથી લાંબુ હાડકું :
- (A) બાયસેપ્સ (B) ટ્રાયસેપ્સ
(C) સાર્ટોરીયસ (D) રેક્ટસ એબ્ડોમીનસ
7. Scientific name of the calf muscle is :
- (A) Hamstrings (B) Quadriceps
(C) Sartorius (D) Gastrocnemius
- કાલ્ફ મસલનું વૈજ્ઞાનિક નામ :
- (A) હેમસ્ટ્રીંગ (B) ક્વોડ્રીસેપ્સ
(C) સાર્ટોરીયસ (D) ગેસ્ટ્રોનેમીયસ
8. Glycogen is stored in :
- (A) Stomach (B) Kidney
(C) Liver (D) Pancreas
- ગ્લાયકોજનનો ભરાવો થાય છે :
- (A) પેટમાં (B) મુત્રપિંડમાં
(C) યકૃતમાં (D) સ્વાદુપિંડમાં

9. Normal blood-sugar level is :

- (A) 90 to 100 mg (B) 100 to 120 mg
(C) 80 to 120 mg (D) 110 to 130 mg

બ્લડ સુગરનું સામાન્ય સ્તર :

- (A) 90 થી 100 મિગ્રા. (B) 100 થી 120 મિગ્રા.
(C) 80 થી 120 મિગ્રા. (D) 110 થી 130 મિગ્રા.

10. Universal blood donors' group is :

- (A) Group O+ (B) Group A
(C) Group AB (D) Group B

સર્વ સ્વીકૃત રક્તદાતાનું બ્લડ ગ્રુપ :

- (A) O+ (ઓ પોઝિટીવ ગ્રુપ) (B) A (એ ગ્રુપ)
(C) AB (એબી ગ્રુપ) (D) B (બી ગ્રુપ)

11. Physical Education teacher-training first started at :

- (A) L.N.C.P.E. (Gwalior)
(B) Y.M.C.A. College of Physical Education (Madras)
(C) Chhotubhai Purani Vyayam Mahavidyalaya (Rajpipla)
(D) Government College of Physical Education (Patiala)

શારીરિક શિક્ષણ તાલીમની પ્રથમ શરૂઆત ક્યાં થઈ :

- (A) એલ.એન.સી.પી.ઈ. (ગ્વાલિયર)
(B) વાય.એમ.સી.એ. કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (મદ્રાસ)
(C) છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય (રાજપીપલા)
(D) ગવર્નમેન્ટ કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન (પતિયાલા)

12. Shoulder joint is :

- (A) Ball and socket joint (B) Pivot joint
(C) Hinge joint (D) Gliding joint

ખભાનો સાંધો છે :

- (A) બોલ અને સોકેટ જોઈન્ટ (B) પીવોટ જોઈન્ટ
(C) હિંજ જોઈન્ટ (D) ગ્લાઈડિંગ જોઈન્ટ

13. The science of Biomechanics is related with :

- (A) Movement of muscles only
- (B) Movement of the whole body
- (C) The movement linked with respiration
- (D) The circulatory system

જીવયાંત્રિક વિજ્ઞાન સંકળાયેલ છે :

- (A) ફક્ત સ્નાયુઓનું હલનચલન
- (B) સંપૂર્ણ શરીરનું હલનચલન
- (C) શ્વસન સાથે હલનચલન
- (D) રૂધિરાભિસરણ તંત્ર

14. Newton's first law of motion is known as :

- (A) Law of acceleration
- (B) Law of action and reaction
- (C) Law of inertia
- (D) Law of interaction

ન્યુટનનો ગતિનો પહેલો નિયમ ઓળખાય છે :

- (A) પ્રવેગનો નિયમ
- (B) આઘાત પ્રત્યાઘાતનો નિયમ
- (C) જડત્વનો નિયમ
- (D) આંતરિક ક્રિયાનો નિયમ

15. Kyphosis is the deformity of :

- (A) Cervical region
- (B) Lumbar region
- (C) Coccygeal region
- (D) Thoracic region

ખૂંધ કયા વિસ્તારનું વિકૃત અંગ ગણાય :

- (A) ગરદનનો ભાગ (સર્વાઈકલ રીજીઅન)
- (B) કમરનો ભાગ (લ્યુમ્બર રીજીઅન)
- (C) કટી નીચેનો ભાગ (કોકસીજીયલ રીજીઅન)
- (D) છાતીનો ભાગ (થોરેસીક રીજીઅન)

16. Indicate the main law of learning :

- (A) The law of action
- (B) The law of transfer
- (C) The law of readiness
- (D) The law of frequency

શીખવાનો મુખ્ય નિયમ જણાવો :

- (A) ક્રિયાનો નિયમ
- (B) સંક્રમણનો નિયમ
- (C) તત્પરતાનો નિયમ
- (D) આવર્તનનો નિયમ

17. Sociometrics is related to :
- (A) Searching the talent in sports (B) Training the athlete
(C) Finding the sociability (D) Study of human mind

સામાજિકતા માપન સંકળાયેલ છે :

- (A) રમતગમતમાં પ્રતિભા શોધવા (B) ખેલાડીની તાલીમ
(C) સામાજિકતા જાણવા (D) માનવીના મનનો અભ્યાસ

18. The age in the years, months and days is known as :

- (A) Anatomical age (B) Chronological age
(C) Psychological age (D) None of these

વર્ષ, મહિનો અને દિવસમાં દર્શાવેલ ઉંમર ઓળખાય છે :

- (A) શરીર રચનાકીય ઉંમર (B) કાલકમાનુસારી ઉંમર
(C) માનસશાસ્ત્રીય ઉંમર (D) એમાંથી કોઈ નહિ

19. The degree of relationship between two variables is known as :

- (A) Correlation (B) Coordination
(C) Both of the above (D) None of the above

બે ભિન્ન ઘટકો (Variables) વચ્ચેના સંબંધની માત્રા ઓળખાય છે :

- (A) કોરીલેશન (સહસંબંધ) (B) કો-ઓર્ડિનેશન (સમન્વય)
(C) બન્ને (D) બન્નેમાંથી કોઈ નહિ

20. Diabetes is caused due to inefficiency of :

- (A) Liver (B) Heart
(C) Pancreas (D) Kidneys

આની ખામીને કારણે મધુપ્રમેહ થાય છે :

- (A) યકૃત (B) હૃદય
(C) સ્વાદુપિંડ (D) મૂત્રપિંડ

21. Fartlek training improves :

- (A) Strength (B) Flexibility
(C) Agility (D) Endurance

ફાર્ટલેક ટ્રેનિંગથી વિકસે છે :

- (A) શક્તિ (B) નમનીયતા
(C) ચપલતા (D) સહનશક્તિ

22. The game starts with 'back pass' in :
 (A) Basketball (B) Football
 (C) Hockey (D) Volleyball
 રમતનો પ્રારંભ 'બેક પાસ' થી થાય છે :
 (A) બાસ્કેટબોલ (B) ફુટબોલ
 (C) હોકી (D) વોલીબોલ
23. The following is the ball game :
 (A) Kabaddi (B) Tennikoit
 (C) Badminton (D) Golf
 નીચેનામાંથી કઈ દડા રમત છે :
 (A) કબડી (B) ટેનીકોઈટ
 (C) બેડમિન્ટન (D) ગોલ્ફ
24. 'F' ratio is used to compare :
 (A) Data (B) More than two means
 (C) Population (D) Two means
 'F' રેશીયોનો ઉપયોગ સરખાવા માટે થાય છે :
 (A) ડેટા (B) બે કરતા વધારે મધ્યક (Mean)
 (C) વસ્તી (D) બે મધ્યક (Mean)
25. The questionnaire tool in research is used in :
 (A) Survey research (B) Experimental research
 (C) Basic research (D) Applied research
 કયા સંશોધનમાં પ્રશ્નોત્તરીનો ઉપયોગ થાય છે :
 (A) સર્વે પ્રકારના સંશોધનમાં (B) પ્રયોગાત્મક સંશોધનમાં
 (C) મૂળભૂત સંશોધનમાં (D) કાર્યાન્વિત સંશોધનમાં
26. AAPHER test is used to measure :
 (A) Psychological fitness (B) Muscular fitness
 (C) Cardiac fitness (D) General fitness
 આફર (AAPHER) કસોટીનો ઉપયોગ માપવા માટે થાય છે :
 (A) મનોવૈજ્ઞાનિક ક્ષમતા (B) સ્નાયુ ક્ષમતા
 (C) હૃદયની ક્ષમતા (D) સાર્વત્રિક ક્ષમતા
27. 'Shuttle run' measures :
 (A) Speed (B) Strength
 (C) Agility (D) Endurance
 શટલ દોડ માપે છે :
 (A) ઝડપ (B) તાકાત
 (C) ચપલતા (D) સહનશક્તિ

28. The following is under the category of intramurals :
- (A) Thomas Cup (B) Interclass
(C) Ranji Trophy (D) Interuniversity

આંતરગૃહ સ્પર્ધાની કક્ષામાં આવે છે :

- (A) થોમસ કપ (B) આંતરવર્ગ
(C) રણજી ટ્રોફી (D) આંતર વિશ્વવિદ્યાલય

29. Mirror method of teaching is most suitable for :

- (A) Hockey (B) Khokho
(C) Dumbbells (D) Cricket

દર્પણ પદ્ધતિનો ઉપયોગ કરવા માટે ખૂબ જ અનુકૂળ પ્રવૃત્તિ :

- (A) હોકી (B) ખો-ખો
(C) ડંબેલ્સ (D) ક્રિકેટ

30. The mattresses are used in :

- (A) Aquatics (B) Tennis
(C) Badminton (D) Gymnastics

ગાદલાઓનો ઉપયોગ કરવામાં આવે છે :

- (A) તરણ (B) ટેનિસ
(C) બેડમિન્ટન (D) જિમ્નાસ્ટિક્સ

31. Physical Education has no relation with recreation :

- (A) True (B) False
(C) Partially true (D) Partially false

શારીરિક શિક્ષણને રંજન સાથે સંબંધ નથી :

- (A) સાચુ (B) ખોટુ
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ

32. Ice treatment is advisable immediately after a sprain :

- (A) True (B) False
(C) Partially false (D) Partially true

મચકોડ પછી તરત બરફના ઉપયોગની ભલામણ કરવામાં આવે છે :

- (A) સાચુ (B) ખોટુ
(C) આંશિક ખોટુ (D) આંશિક સાચુ

33. Massage is useful in rehabilitation :
- (A) True (B) False
(C) Both (D) None of these
- પુનર્વસનમાં માલીશ ઉપયોગી છે :
- (A) સાચુ (B) ખોટુ
(C) બન્ને (D) કોઈ નહિ
34. Television helps in popularising the sports :
- (A) True (B) False
(C) Partially true (D) Partially false
- રમતગમતને લોકપ્રિય બનાવવામાં દૂરદર્શન મદદરૂપ બને છે :
- (A) સાચુ (B) ખોટુ
(C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ
35. Training is *not* essential for being an efficient physical education teacher :
- (A) Partially True (B) Partially False
(C) True (D) False
- કુશળ શારીરિક શિક્ષણના શિક્ષક બનવા માટે તાલીમ જરૂરી નથી :
- (A) આંશિક સાચુ (B) આંશિક ખોટુ
(C) સાચુ (D) ખોટુ
36. Vitamins produce energy in the body :
- (A) True (B) False
(C) Both (D) None of these
- વિટામિન્સ શરીરમાં શક્તિ ઉત્પન્ન કરે છે :
- (A) સાચુ (B) ખોટુ
(C) બન્ને (D) એમાંથી કોઈ નહિ
37. Off-side rule is *not* applicable in Hockey :
- (A) True (B) False
(C) Both (D) None of these
- હોકીમાં ઓફસાઈડનો નિયમ લાગુ પડતો નથી :
- (A) સાચુ (B) ખોટુ
(C) બન્ને (D) એમાંથી કોઈ નહિ

38. In research, hypothesis always proves to be correct :
 (A) True (B) False
 (C) Partially true (D) Partially false
 સંશોધનમાં ઉત્કલ્પના હંમેશા સાચી સાબિત થાય છે :
 (A) સાચુ (B) ખોટુ
 (C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ
39. 'Chin-ups' measure muscular endurance :
 (A) True (B) False
 (C) Partially true (D) Partially false
 'ચીનઅપ્સ' સ્નાયુની સહનશક્તિનું માપન કરે છે :
 (A) સાચુ (B) ખોટુ
 (C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ
40. Pupil-teacher interaction is *not* essential for effective education :
 (A) True (B) False
 (C) Both (D) None of these
 અસરકારક શિક્ષણ માટે શિક્ષક-વિદ્યાર્થી આંતરિક ક્રિયા જરૂરી નથી :
 (A) સાચુ (B) ખોટુ
 (C) બન્ને (D) એમાંથી કોઈ નહિ
41. Personality is linked only with physical qualities :
 (A) True (B) False
 (C) Partially true (D) Partially false
 વ્યક્તિત્વનો સંબંધ ફક્ત શારીરિક ગુણો સાથે છે :
 (A) સાચુ (B) ખોટુ
 (C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ
42. Spiro-metre is used for measuring Vital Capacity :
 (A) True (B) False
 (C) Partially true (D) Partially false
 સ્પાયરોમીટરનો ઉપયોગ શ્વસન ક્ષમતા (Vital Capacity) માપવા માટે થાય છે :
 (A) સાચુ (B) ખોટુ
 (C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ
43. The implement thrown at an angle of 45° covers maximum distance :
 (A) True (B) False
 (C) Partially true (D) Partially false
 45° ખૂણે ફેંકવામાં આવતું સાધન વધારેમાં વધારે અંતર પ્રાપ્ત કરે છે :
 (A) સાચુ (B) ખોટુ
 (C) આંશિક સાચુ (D) આંશિક ખોટુ

44. There is a Timekeeper in Football :

- (A) True (B) False
(C) Partially true (D) Partially false

ફુટબોલમાં સમયપંચ હોય છે :

- (A) સાચું (B) ખોટું
(C) આંશિક સાચું (D) આંશિક ખોટું

Note :— Answer the questions 45 to 50 by matching List I with List II and select the correct answer using the codes given below the lists.

સૂચના :— પ્રશ્ન નંબર 45 થી 50 ના જવાબો યાદિ I ને યાદિ II સાથે જોડી કોડમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ જણાવો.

45. List I List II
- | | |
|-----------------|-------------------|
| (a) Capillaries | (1) Kidney |
| (b) Oxygen | (2) Lungs |
| (c) Thyroxin | (3) Blood |
| (d) Urea | (4) Pancreas |
| | (5) Thyroid gland |

Code :

- | | | | |
|---------|-----|-----|-----|
| (a) | (b) | (c) | (d) |
| (A) (3) | (2) | (5) | (1) |
| (B) (2) | (5) | (1) | (4) |
| (C) (4) | (3) | (2) | (5) |
| (D) (1) | (4) | (3) | (2) |

યાદિ I

- (a) કેશવાહિનીઓ
(b) ઓક્સીજન
(c) થાયરોક્સિન
(d) યુરિયા

યાદિ II

- (1) મૂત્રપિંડ
(2) ફેફસા
(3) લોહી
(4) સ્વાદુપિંડ
(5) કંઠસ્થગ્રંથિ

કોડ :

- | | | | |
|---------|-----|-----|-----|
| (a) | (b) | (c) | (d) |
| (A) (3) | (2) | (5) | (1) |
| (B) (2) | (5) | (1) | (4) |
| (C) (4) | (3) | (2) | (5) |
| (D) (1) | (4) | (3) | (2) |

46.

List I

- (a) Anatomy
- (b) Physiology
- (c) Psychology
- (d) Sociology

List II

- (1) Function
- (2) Behaviour
- (3) Society
- (4) Body Structure
- (5) Recreation

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(5)	(1)	(4)
(B)	(4)	(1)	(2)	(3)
(C)	(3)	(2)	(5)	(1)
(D)	(1)	(4)	(3)	(2)

याद्वि I

- (a) शरीर रचना
- (b) शरीरशास्त्र
- (c) मानसशास्त्र
- (d) समाजशास्त्र

याद्वि II

- (1) कार्य
- (2) वर्तणुक्त
- (3) समाज
- (4) शरीर बांधो
- (5) रंजन

कोड :

	(a)	(b)	(c)	(d)
(A)	(2)	(5)	(1)	(4)
(B)	(4)	(1)	(2)	(3)
(C)	(3)	(2)	(5)	(1)
(D)	(1)	(4)	(3)	(2)

47.

List I

List II

Asian Games (City)

Asian Games (Year)

- | | |
|---------------|----------|
| (a) Tokyo | (1) 1982 |
| (b) Bangkok | (2) 1970 |
| (c) New Delhi | (3) 2002 |
| (d) Busan | (4) 1958 |
| | (5) 1964 |

Code :

- | | | | | |
|-----|-----|-----|-----|-----|
| | (a) | (b) | (c) | (d) |
| (A) | (1) | (3) | (2) | (4) |
| (B) | (3) | (4) | (5) | (1) |
| (C) | (4) | (2) | (1) | (3) |
| (D) | (5) | (1) | (4) | (2) |

याद्वि I

याद्वि II

अशियन गेम्स (शहर)

अशियन गेम्स (वर्ष)

- | | |
|-----------------|----------|
| (a) टोक्यो | (1) 1982 |
| (b) बेंगकोक | (2) 1970 |
| (c) न्यु दिल्ली | (3) 2002 |
| (d) बुसान | (4) 1958 |
| | (5) 1964 |

कोड :

- | | | | | |
|-----|-----|-----|-----|-----|
| | (a) | (b) | (c) | (d) |
| (A) | (1) | (3) | (2) | (4) |
| (B) | (3) | (4) | (5) | (1) |
| (C) | (4) | (2) | (1) | (3) |
| (D) | (5) | (1) | (4) | (2) |

48.

List I

- (a) Maradona
(b) Steffee Graf
(c) Pulela Gopichand
(d) Anjali Vedpathak Bhagwat

List II

- (1) Shooting
(2) Badminton
(3) Football
(4) Tennis
(5) Khokho

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(5)
(B)	(2)	(5)	(4)	(3)
(C)	(4)	(3)	(5)	(2)
(D)	(3)	(4)	(2)	(1)

याद्वि I

- (a) डेररडोना
(b) स्टेफी ग्राफ
(c) पुलेला गोपीचंद
(d) अंजली वेदपाठक भागवत

याद्वि II

- (1) शूटींग
(2) बैडमिन्टन
(3) फुटबोल
(4) टेनिस
(5) खो-खो

कोड :

	(a)	(b)	(c)	(d)
(A)	(1)	(2)	(3)	(5)
(B)	(2)	(5)	(4)	(3)
(C)	(4)	(3)	(5)	(2)
(D)	(3)	(4)	(2)	(1)

49. List I

- (a) FILA
- (b) FINA
- (c) IHF
- (d) AAFI

List II

- (1) Hockey
- (2) Athletics
- (3) Aquatics
- (4) Wrestling
- (5) Handball

Code :

- | | (a) | (b) | (c) | (d) |
|-----|-----|-----|-----|-----|
| (A) | (4) | (3) | (1) | (2) |
| (B) | (3) | (4) | (2) | (1) |
| (C) | (2) | (5) | (3) | (4) |
| (D) | (1) | (2) | (4) | (3) |

યાદિ I

- (a) FILA
- (b) FINA
- (c) IHF
- (d) AAFI

યાદિ II

- (1) હોકી
- (2) એથલેટિક્સ (ખેલકૂદ)
- (3) તરણ
- (4) કુસ્તી
- (5) હેન્ડબોલ

કોડ :

- | | (a) | (b) | (c) | (d) |
|-----|-----|-----|-----|-----|
| (A) | (4) | (3) | (1) | (2) |
| (B) | (3) | (4) | (2) | (1) |
| (C) | (2) | (5) | (3) | (4) |
| (D) | (1) | (2) | (4) | (3) |

50.

List I

- (a) Arjun Award
(b) Dronacharya Award
(c) Maulana Abul Kalam
Azad Trophy
(d) Grand Slam

List II

- (1) Best University in Sports
(2) All round Tennis Player
(3) Outstanding Sports Organizer
(4) Best Coach
(5) Best Player

Code :

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(4)	(1)	(2)
(B)	(4)	(3)	(2)	(5)
(C)	(3)	(5)	(4)	(1)
(D)	(2)	(1)	(3)	(4)

યાદિ I

- (a) અર્જુન એવોર્ડ
(b) દ્રોણાચાર્ય એવોર્ડ
(c) મૌલાના અબુલ કલામ
આઝાદ ટ્રોફી
(d) ગ્રાંડ સ્લામ

યાદિ II

- (1) રમતગમતમાં શ્રેષ્ઠ વિશ્વવિદ્યાલય
(2) ઓલરાઉન્ડ ટેનિસ ખેલાડી
(3) શ્રેષ્ઠ ખેલ સંચાલક
(4) શ્રેષ્ઠ રાહબર
(5) શ્રેષ્ઠ ખેલાડી

કોડ :

	(a)	(b)	(c)	(d)
(A)	(5)	(4)	(1)	(2)
(B)	(4)	(3)	(2)	(5)
(C)	(3)	(5)	(4)	(1)
(D)	(2)	(1)	(3)	(4)



ROUGH WORK

ROUGH WORK

SEAI